



Established by Late Shri Rasikbhai G. Shah & Managed by Ahmedabad Kelavani Trust

Ahmedabad Arts & Commerce College

(Accredited by NAAC & Affiliated to Gujarat University)
Near Telephone Exchange, Vasna, Ahmedabad – 380 007.

Code No.: 008
Uni. Code No. 065
UGC recognized 2(f) & 12(B)

Tel No.: 079-26605559
E-mail: aacc065@gmail.com
Website: www.aacc.edu.in

NOTICE REGARDING ASSIGNMENT B.COM Sem - 6

1. BCOM ના વિદ્યાર્થીઓએ તમામ વિષયો માટે અસાઈનમેન્ટ ફરજિયાતપણે OFFLINE મોડમાં submit કરવાના રહેશે. BCOM students must compulsorily submit assignments in OFFLINE mode for all subjects.

2. અસાઈનમેન્ટ A4 સાઈઝ ના પાપર્સમાં પોતાના હસ્તાક્ષરમા લખવાના રહેશે.

Assignment should be written in own handwriting on A4 size papers

3. પ્રથમ પેજનો નમૂનો નીચે આપેલ છે જેની પ્રિન્ટ-આઉટ લઈને અસાઈનમેન્ટની સાથે જોડવાનો રહેશે, A sample of the first page is given below, a print-out of which is to be taken and enclosed with the assignment

4. બીજા પેજ પર INDEX જેનો નમૂનો નીચે આપેલો છે એની પ્રિન્ટ આઉટ લઈને જોડવાની રહેશે,

On the second page, printout of the INDEX sample of which is given below has to be attached,

5. ત્રીજા પેજ પર સર્ટિફિકેટ જેનો નમૂનો નીચે આપેલો છે એની પ્રિન્ટ આઉટ લઈને જોડવાની રહેશે.

On the third page, a print out of the certificate, specimen of which is given below, has to be attached.

6. દરેક પેજ પર વિદ્યાર્થીએ પોતાનું નામ, રોલ નંબર અને સિગ્નેચર કરવાની રહેશે.

The student has to put his name, roll number and signature on each page.

7. દરેક પેજ નીચે પેજ નંબર આપવો જરૂરી છે.

It is necessary to give page number at the bottom of each page.

8. અસાઈનમેન્ટ સબમીટ કરવું ફરજિયાત છે જેની નોંધ લેવી.

Assignment submission is mandatory for all the students for internal scoring internal marks.



Established by Late Shri Rasikbhai G. Shah & Managed by Ahmedabad Kelavani Trust

Ahmedabad Arts & Commerce College

(Accredited by NAAC & Affiliated to Gujarat University)

Near Telephone Exchange, Vasna, Ahmedabad – 380 007.

Code No.: 008

Uni. Code No. 065

UGC recognized 2(f) & 12(B)

Tel No.: 079-26605559

E-mail: aacc065@gmail.com

Website: www.aacc.edu.in

DETAILS OF THE STUDENT FOR ASSIGNMENT SUBMISSION

NAME OF THE STUDENT: _____

STREAM (BA/BCOM/MA ENGLISH/MA GUJARATI/MCOM): _____

ROLL NUMBER: _____

ABC ID NUMBER : _____

SEMESTER: _____

SUBJECT: _____

PAPER NUMBER & NAME: _____

SIGNATURE OF THE STUDENT: _____



Established by Late Shri Rasikbhai G. Shah & Managed by Ahmedabad Kelavani Trust

Ahmedabad Arts & Commerce College

(Accredited by NAAC & Affiliated to Gujarat University)
Near Telephone Exchange, Vasna, Ahmedabad – 380 007.

Code No.: 008
Uni. Code No. 065
UGC recognized 2(f) & 12(B)

Tel No.: 079-26605559
E-mail: aacc065@gmail.com
Website: www.aacc.edu.in

INDEX

SR. NO.	CONTENT	PAGE NO.



Established by Late Shri Rasikbhai G. Shah & Managed by Ahmedabad Kelavani Trust

Ahmedabad Arts & Commerce College

(Accredited by NAAC & Affiliated to Gujarat University)

Near Telephone Exchange, Vasna, Ahmedabad – 380 007.

Code No.: 008

Uni. Code No. 065

UGC recognized 2(f) & 12(B)

Tel No.: 079-26605559

E-mail: aacc065@gmail.com

Website: www.aacc.edu.in

CERTIFICATE OF ASSIGNMENT SUBMISSION

Mr./Miss _____

Roll Number _____ has successfully submitted assignment of

Stream & Semester _____

Subject _____

Date _____.

Student Sign

Faculty Sign

B. COM. SEMESTER – 6

Assignment (NEP – 2020)

CORPORATE ACCOUNTING -2

Q-1: The Indian Traders Ltd. proposes to purchase the business carried on by Gujarat Traders. Goodwill for this purpose is agreed to be valued at three years' purchase of the super profit based on average profit of the just four years. The appropriate weights to be used are : 2008- 1, 2009- 2, 2010 -3, 2011 -4

The profits for these years are :

2008 Rs. 10,100 2009 Rs. 12,400

2010 Rs. 10,000 2011 Rs. 15,000

On a scrutiny of the accounts the following matters are revealed :

(1) On 1st September, 2010 a major repair was made in respect of the plant incurring Rs. 3,000 which amount was charged to revenue. The said sum is agreed to be capitalized for goodwill calculation subject to adjustment of depreciation at 10% p.a. on reducing balance method.

(2) The closing stock for the year 2009 was overvalued by Rs. 1,200 to made for the purpose of goodwill valuation.

(3) To cover management cost an annual charge of Rs. 2,400 should be made for the purpose of goodwill valuation.

(4) Capital employed in business is Rs. 80,000 and expected rate of return is 10%

Compute the value of goodwill of the firm.

Q-2: The following is the balance sheet of Jagit Co.Ltd. as on 31-3-12

Liabilities	Rs.	Assets	Rs.
2,000 6% Preference shares of Rs. 100 each	2,00,000	Fixed Assets	5,00,000
		Current Assets	2,50,000
5,000 Equity shares of Rs. 100 each	5,00,000	Preliminary Expenses	50,000
Reserve	50,000		
Depreciation Fund	30,000		
Creditors	20,000		
	8,00,000		8,00,000

Other Information:

(1) Fixed Assets are valued at Rs. 6,00,000.

(2) Current Assets are valued at Rs. 2,00,000.

(3) Preference shareholders have preference as regards capital and dividend.

Find out the value of Equity shares by Net Assets Method.

Q-3. The balance sheet of two companies A Ltd. and B Ltd. as on 31-03-2022 are as under.

LIABILITIES	A Ltd	B Ltd	ASSETS	A Ltd	B Ltd
Equity shares each of 10	1600000	600000	Fixes Assets	2200000	946000
12% p.s.c 10 each	-	200000	Stock	500000	194000
Profit & loss ac	112600	71000	Debtors	250000	120000
Inv. Rebate Reserve	78000	25000	Cash and Bank	50000	80000
General Reserve	9220000	196000			
12% Debentures	-	50000			
Creditors	200000	140000			
Bills Payable	87400	58000			
	3000000	1340000		3000000	1340000

A Ltd decided to absorb the business of B Ltd. On 1-4-22 which follows condition.

1. The equity shareholder of B ltd will be given fully paid up 70000 equity shares of A ltd of Rs. 10 each.
2. The Preference shareholder of B ltd will be given 12% 2200 preference shares of A ltd.
3. Debenture shareholder of B ltd will be given 15% 2200 New Debenture of A ltd. So that company can receive the same amount of interest as per last year.
4. Investment Rebate reserve is to be kept for another two years.

Prepare balance sheet after amalgamation.

- (a) Amalgamation is in the nature of merger.
- (b) Amalgamation is in the nature of purchase.

Q-4 Give journal entries in the book of the B ltd on absorption using the above balance sheet.

B. COM. SEMESTER – 6
Assignment (NEP – 2020)
CORPORATE ACCOUNTING -2

પ્રશ્ન-૧ ઇન્ડિયન ટ્રેડર્સ ગુજરાત ટ્રેડર્સનો ધંધો ખરીદવા માંગે છે. આ હેતુ માટે છેલ્લા ચાર વર્ષના ભારિત સરેરાશ નફાને આધારે નફાની ત્રણ ગણી રકમ પાઘડીની રકમ જણાવવાનું નક્કી કરવામાં આવે છે. નીચે મુજબ ભાર આપવાનો છે.

૨૦૦૮ ૧ ૨૦૦૯ ૨ ૨૦૧૦ ૩ ૨૦૧૧ ૪

આ વર્ષ દરમિયાન નફો નીચે મુજબ હતો. : ૨૦૦૮ : ૧૦, ૧૦૦ ; ૨૦૦૯ : રૂ. ૧૨, ૪૦૦ ૨૦૧૦ : રૂ.

૧૦,૦૦૦; ૨૦૧૧ : રૂ. ૧૫,૦૦૦; હિસાબો તપાસતા નીચેની માહિતી મળે છે.

(૧) તા. ૧લી સપ્ટેમ્બર, ૨૦૧૦ના રોજ પ્લાન્ટ માં મોટા પાયા પર સમારકામ કરવામાં આવ્યું અને રૂ. ૩,૦૦૦ ખર્ચ કર્યો. જે ખર્ચ તરીકે નફાનુકસાન ખાતે ઉધારવામાં આવ્યા હતા. પરંતુ પાઘડી ના મૂલયાંકન માટે આ રકમ મૂડી ખર્ચ ગણવાની છે. ઘટ્ટી જતી બાકીની પદ્ધતિ મુજબ ૧૦% લેખે ઘસારાનો હવાલો નાખવાનો છે.

(૨) ૨૦૦૯ માં આખર સ્ટોકની કીમત રૂ. ૧,૨૦૦ વધ આંકવામાં આવી છે.

(૩) સંચાલન ખર્ચ માટે વાર્ષિક રૂ. ૨,૪૦૦ ઉધારવાના છે.

(૪) ધંધામાં રોકાયેલી મૂડી રૂા ૮૦,૦૦૦ છે અને અપેક્ષિત વળતરનો દર ૧૦% છે.

પેઢીની પાઘડીની રકમ શોધી કાઢો.

પ્રશ્ન-૨

જયજગત કંપની લિ. નું તા.૩૧-૭-૨૦૧૨ ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે.

મૂડી-દેવાં	રૂ.	મિલકત લેણાં	રૂ.
૬% ના પ્રેફ. શેર	૨,૦૦,૦૦૦	સ્થિર મિલકતો	૫,૦૦,૦૦૦
(દરેકરૂ. ૧૦૦ નો તેવા ૨,૦૦૦)		ચાલુ મિલકતો	૨,૫૦,૦૦૦
૫,૦૦૦ ઇ. શેર દરેક રૂ. ૧૦૦ નો તેવા		પ્રાથમિક ખર્ચા	૫૦,૦૦૦
	૫,૦૦,૦૦૦		
અનામત	૫૦,૦૦૦		
ઘસારા ફંડ	૩૦,૦૦૦		
લેણદારો	૨૦,૦૦૦		
	૮,૦૦,૦૦૦		૮,૦૦,૦૦૦

અન્ય માહિતી:

- (૧) સ્થિર મિલકતોની કિંમત રૂ. ૬,૦૦,૦૦૦ આંકવામાં આવી હતી.
 (૨) યાવુ મિલકતોની કિંમત રૂ. ૨,૦૦,૦૦૦ આંકવામાં આવી હતી.
 (૩) પ્રેફરન્સ શેરહોલ્ડરોને મુડી તથા ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ અધિકાર છે.
 યોજ્ઞા મિલકતોના ધોરણે ઇક્વિટીશેરની કિંમત શોધો.

પ્રશ્ન-૩એ લિ. અને બી. લિ. ના તા. ૩૧મી માર્ચ, ૨૦૨૧ ના રોજના પાકા સરવૈયા નીચે મુજબ છે.

પાકા સરવૈયા

વિગત	એ લિ.	બી લિ.
I. ઇલિટી અને જવાબદારીઓ		
(૧) શેરહોલ્ડરોના ભંડોળો:		
(અ) શેરમૂડી: ઇલિટી શેરમૂડી	૧૬,૦૦,૦૦૦	૬,૦૦,૦૦૦
રૂ. ૧૦નો શેર પૂરો ભરાયેલ		
૧૨%નીપ્રેફરન્સ શેર મૂડી	-	૨,૦૦,૦૦૦
દરકે રૂ. ૧૦નોશેર		
(બ) અનામત અને વધારો:		
સામાન્ય અનામત	૮,૨૨,૦૦૦	૧,૮૬,૦૦૦
રોકાણ વળતર અનામત	૭૮,૦૦૦	૨૫,૦૦૦
નફા-નુકશાન ખાતું	૧,૧૨,૬૦૦	૭૧,૦૦૦
(૨) બિનયાવુ દેવાં		
(અ) લાંબાગાળાના ઉછીનાં નાણા:		
૧૨%ના ડિબેન્ચર્સ	-	૫૦,૦૦૦
(૩) યાવુ દેવાં:		
(અ) વેપારી દેવાં		
લેણદારો	૨,૦૦,૦૦૦	૧,૪૦,૦૦૦
દેવી હૂંડી	૮૭,૪૦૦	૫૮,૦૦૦
કુલ	૩૦,૦૦,૦૦૦	૧૩,૪૦,૦૦૦
II. મિલકતો:		
(૧) બિનયાવુ મિલકતો		
(અ) કાયમી મિલકતો	૨૨,૦૦,૦૦૦	૮,૪૬,૦૦૦
(૨) યાવુ મિલકતો:		
(અ) માલસામગ્રી: સ્ટોક	૫,૦૦,૦૦૦	૧,૧૮૪,૦૦૦
(બ) વારીલેણાં: દેવાદારો	૨,૫૦,૦૦૦	૧,૨૦,૦૦૦
(ક) રોકડ અને રોકડ સ્વરૂપની મિલકતો:		
બેંક સિલક	૫૦,૦૦૦	૮૦,૦૦૦
કુલ	૩૦,૦૦,૦૦૦	૧૩,૪૦,૦૦૦

૧ એલપ્રિ, ૨૦૨૧ના રોજ એ લિ., બી લિ. ને નીચેની શરતો એ સમાવીલેવાનું નક્કી કર્યું.

1. એ લિ. બી લિ. ના પ્રેફરન્સ શેરહોલ્ડરોને રૂ. ૧૦૦નો એક એવા ૭૦,૦૦૦ ઇક્વિટી શેર પૂરેપૂરા ભરપાઈ થયેલા આપશે
2. એ લિ. બી લિ. ના પ્રેફરન્સ શેર હોલ્ડરોને રૂ. ૧૦૦નો એક એવા ૨૨૦૦ ૧૨%ના પ્રેફરન્સ શેર આપશે.
3. બી લિ. ના ડીબેન્યરના બદલામાં એ લિ. ના નવા ૧૫% ના ડીબેન્યર એ રીતે આપવામાં આવશે કે જેથી તેમને અગાઉ જેટલી જ આવક થાય.
4. રોકાણ વળતર અને અનામતને હજુ બીજા બે વર્ષ માટે રાખવું જરૂરી છે.

ઉપરની વિગતોને આધારે નીચેના સંજોગોમાં સંયોજન પછીનું એ લિ. નું પાકું સરવૈયું બનાવો:

(અ) જો સંયોજન વિલીની કરણસ્વરૂપ નું હોય

(બ) જો સંયોજન ખરીદીસ્વરૂપ નું હોય.

પ્રશ્ન-૪ કંપનીના સમાવેશકરતી વખતે બી લિ ના ચોપડામાં થતી આમનોંધો લખો

B. COM. SEMESTER – 6

Assignment (NEP – 2020)

AUDITING – 2

- Q. 1 State the primary difference between a Management Audit and an Operational Audit.
- Q. 2 Explain the primary limitation of the audit technique Observation.
- Q. 3 Distinguish between a Qualified Opinion and an Adverse Opinion with respect to the pervasiveness of the misstatement.
- Q. 4 What is the difference between IT General Controls audit and Cyber Security audit?

B. COM. SEMESTER – 6

Assignment (NEP – 2020)

AUDITING – 2

- Q. 1 મેનજમેન્ટ ઓડીટ અને ઓપરેશનલ ઓડીટ વચ્ચેનો મુખ્ય તફાવત જણાવો.
- Q. 2 નિરીક્ષણ ઓડીટ તકનીકની પ્રાથમિક મર્યાદા સમજાવો.
- Q. 3 ખોટા નિવેદનની વ્યાપકતાના સંદર્ભમાં શરતી અભિપ્રાય અને પ્રતિકુળ અભિપ્રાય વચ્ચેનો તફાવત જણાવો.
- Q. 4 આઈટી જનરલ કંટ્રોલ્સ ઓડીટ અને સાયબર સિક્યુરિટી ઓડીટ વચ્ચે શું તફાવત છે?

B. COM. SEMESTER – 6

Assignment (NEP – 2020)

IKS in Accounting

- (1) Discuss the concepts of Vedic & Puranic Taxes.
- (2) Discuss Accounting Techniques & Methods.
- (3) Discuss Financial Reporting Concepts and Ethical frame Works.
- (4) Role of SEBI, ICAI & other Regulations in Promoting Ethics.

B. COM. SEMESTER – 6

Assignment (NEP – 2020)

IKS in Accounting

- (1) વૈદિક અને પૌરાણીક કરવેરાના ખ્યાલો ચર્ચો.
- (2) હિસાબીય પ્રવિધી/ટેકનીક અને પદ્ધતિઓ વિશે ચર્ચા કરો.
- (3) નાણાકીય અહેવાલો ના ખ્યાલો અને નૈતિક માળખાની ચર્ચા કરો.
- (4) સેબી, આઈ.સી.એ.આઈ. & બીજી અન્ય નીતીશાસ્ત્રને પ્રોત્સાહન આપવા માટેના નિયમો વિશે/ભૂમિકા વિશે ચર્ચા કરો

ASSIGNMENT
B.Com Sem – 6
Subject : Sampling in Research [Statistics]
Course Code : DSC – M – STAT – 364

ENGLISH MEDIUM

- Q. 1 [A] State the characteristics of good sample.
[B] What is population and sample study? Write difference between them.
- Q. 2 [A] Write a note on simple random sampling.
[B] Explain the methods of simple random sampling.
- Q. 3 [A] What is Cluster sampling? How it differs from stratified sampling?
[B] Explain stratified random sampling method.
- Q. 4 [A] Write a short-note on Research process.
[B] Explain the characteristics of good Research.

Q. 5 MCQ

- [1] sampling method is non-probability sampling method.
(a) Simple random
(b) Stratified random
(c) Cluster
(d) Quota
- [2] A sample selected from a population consists which of the following?
(a) All units of the population.
(b) Only 50% of the units of the population.
(c) Only 15% of the units of the population.
(d) Some units of the population.

- [3] A parameter and statistics respectively are characteristics of which of the following?
- (a) Population and sample
 - (b) sample and population
 - (c) Sample and sample
 - (d) Population and population
- [4] Which sampling is affected the most if there is hidden periodicity in population?
- (a) Simple random sampling
 - (b) Stratified random sampling
 - (c) Systematic sampling
 - (d) Both (b) & (c)
- [5] A security checkpoint that checks every vehicle entering into the mall is an example of which of the following?
- (a) Census inquiry
 - (b) Stratified random sampling
 - (c) Systematic sampling
 - (d) Simple random sampling

ASSIGNMENT
B.Com Sem – 6
Subject : Sampling in Research [Statistics]
Course Code : DSC – M – STAT – 364

ગુજરાતી માધ્યમ

- પ્રશ્ન-1 [A] સારા નિદર્શની લાક્ષણિકતાઓ જણાવો.
[B] સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ એટલે શું? તેમની વચ્ચેનો તફાવત લખો.
- પ્રશ્ન-2 [A] સરળ યાદચ્છિક નિદર્શન વિશે નોંધ લખો.
[B] સરળ યાદચ્છિક નિદર્શન પધ્ધતિઓ સમજાવો.
- પ્રશ્ન-3 [A] ગુચ્છ નિદર્શન પધ્ધતિ એટલે શું? તે સ્તરિત યાદચ્છિક નિદર્શનથી કેવી રીતે અલગ પડે છે?
[B] સ્તરિત યાદચ્છિક નિદર્શન પધ્ધતિ સમજાવો.
- પ્રશ્ન-4 [A] સંશોધનની પ્રક્રિયા પર ટૂંકનોંધ લખો.
[B] સારા સંશોધનની લાક્ષણિકતાઓ સમજાવો.

પ્રશ્ન-5 MCQ

- [1] નિદર્શન પધ્ધતિએ બિનસંભાવનાયુક્ત નિદર્શન પધ્ધતિ છે.
(a) સરળ યાદચ્છિક
(b) સ્તરિત યાદચ્છિક
(c) ગુચ્છ નિદર્શન
(d) હિસ્સા નિદર્શન
- [2] એક સમષ્ટિમાંથી પસંદ કરેલ નિદર્શમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે?
(a) સમષ્ટિના બધા જ એકમો
(b) સમષ્ટિના ફક્ત 50% એકમો
(c) સમષ્ટિના ફક્ત 15% એકમો
(d) સમષ્ટિના કેટલાક એકમો
- [3] પ્રાયલ અને આગણક અનુક્રમે કોના કોના લક્ષણ છે?
(a) સમષ્ટિ અને નિદર્શ
(b) નિદર્શ અને સમષ્ટિ
(c) નિદર્શ અને નિદર્શ
(d) સમષ્ટિ અને સમષ્ટિ
- [4] જો સમષ્ટિમાં ધૂપા આવર્તન હોય તો કઈ નિદર્શન પધ્ધતિ પર તેની અસર સૌથી વધુ થાય છે?
(a) સરળ યાદચ્છિક નિદર્શન
(b) સ્તરિત યાદચ્છિક નિદર્શન
(c) પદ્ધિક નિદર્શન
(d) (b) અને (c) બંને

[5] કોઇ મોલમાં પ્રવેશતા દરેક વાહનની સલામતી કારણોસર થતી ચકાસણી નીચેના પૈકી શાનું ઉદાહરણ છે?

- (a) સમષ્ટિ તપાસ
- (b) સ્તરિત યાદ્દશ્ચિક નિદર્શન
- (c) પદ્ધિક નિદર્શન
- (d) સરળ યાદ્દશ્ચિક નિદર્શન

B. Com. Semester-6

Assignment

AEC-365: Fundamentals of Communication in English-II

Q.-1 (A) Explain in detail the Five Senses of Communication.

OR

Q.-1 (B) Write a detailed note on the Features of Communication.

Q.-2 (A) Briefly evaluate the Importance of Communication.

OR

Q.-2 (B) Briefly discuss the Flow of Communication.

Q.-3 (A) Describe the various Strategies of Effective Communication.

OR

Q.-3 (B) Discuss the Role of Feedback in Communication.

Q.-4 (A) Re-write the sentences using correct options:

1. The movie_____ gave the film a bad review. (critic / critical / critique)
2. He spoke with great _____. (confident / confidant / confidence)
3. Paris is the _____ of France (capital / capitol / capita)
4. Her speech was highly _____. (affect / effect / effective)
5. She _____ declined the offer. (respectful / respectfully / respectively)
6. New York is a bustling _____. (city / downtown / town)
7. The _____ gave the soldiers their orders. (colonel / kernel / cornel)
8. They hired an _____ engineer. (electric / electrical / electronic)

Q.-4 (B) Match the following:

A	B
Adept	Praise or kind words
Famous	Skillful
Compliment	A light evening meal
Supper	Qualified
Eligible	Well-known

Q.-5 Choose the correct options:

1. Which is not one of the five primary senses used in communication?
a) Sight b) Touch c) Balance d) Smell
2. Communication is considered purpose-driven because:
a) It is random
b) It always entertains
c) It aims to achieve specific goals
d) It never changes
3. Which of the following is a key benefit of effective communication?
a) Increasing misunderstandings
b) Building strong relationships

- c) Creating a negative work environment
 - d) Hindering decision-making
4. Communication that travels from subordinates to superiors is known as:
- a) Downward Flow
 - b) Upward Flow
 - c) Horizontal Flow
 - d) Diagonal Flow
5. Which of the following is a characteristic of effective feedback?
- a) It is vague and general
 - b) It is focused on personal attacks
 - c) It is timely and specific
 - d) It is delayed and infrequent
6. What is the meaning of the word 'colonel'?
- a) High-ranking officer in military
 - b) Cooking seed
 - c) Religious leader
 - d) Farming tool
7. What does 'finance' mean?
- a) Money management
 - b) Legal advice
 - c) Food science
 - d) Computer repair
8. What does 'solicit' mean?
- a) Give without return
 - b) Ask formally or urgently
 - c) Offer assistance
 - d) Ignore request
